

STEP BY STEP PROCEDURE TO ACQUIRE PROVISIONAL ELIGIBILITY CERTIFICATE FOR CBSE, NIOS AND OTHER BOARD STUDENTS EXCEPT GUJARAT BOARD

- ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડથી ધોરણ 12 પાસ થયેલ વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષ પ્રવેશ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી **PROVISIONAL ELIGIBILITY CERTIFICATE** (પ્રોવિઝનલ એલિજબીલીટી સર્ટિફિકેટ) મેળવવું ફરજિયાત છે.
- ઉપરોક્ત સર્ટિફિકેટ મેળવવાની પૂર્ણ પ્રક્રિયા ONLINE છે. જેના અંતર્ગત નીચે પ્રમાણે પ્રક્રિયા કરવાની રહેશે:
 1. પ્રથમ, નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી અને સંપૂર્ણ પ્રક્રિયાની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી.
<http://forms.saurashtrauniversity.edu/rulesprovisionalcertificate>
 2. ત્યારબાદ, AGREE બટન પર ક્લિક કરી અને આગળ વધવું.
 3. ત્યારબાદ પોતાનું ફોર્મ ભરવું. ફોર્મ ભરતી વખતે બધી માહિતી સાચી હોય એનું ખાસ ધ્યાન રાખવું. પોતાનો મોબાઈલ નંબર અને ઈ-મેઇલ બરાબર છે અને સક્રિય છે એ પણ ધ્યાનમાં રાખવું.
 4. તમામ દર્શાવેલ ડોક્યુમેન્ટ્સ ફોર્મ સાથે અપલોડ કરવાના રહેશે.
 5. ફોર્મ ભર્યા બાદ નીચે Terms & Conditions પર Agree ક્લિક કરી અને આગળ વધવું.
 6. ત્યારબાદ પોતાની ફીસ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી.
 7. તમામ માહિતી સાચી હોય એનું ખાસ ધ્યાન રાખવું.
 8. ત્યારબાદ પોતાની ફી ભર્યાની RECEIPT મેળવી લેવી અને સાચવી રાખવી.
 9. ત્યારબાદ, યુનિવર્સિટી દ્વારા તમારું ફોર્મ ચકાસવામાં આવશે.
 10. સંપૂર્ણ ચકાસણી સફળતાપૂર્વક થયા બાદ તમારા ફોર્મમાં આપેલા ઈમેઇલમાં યુનિવર્સિટી દ્વારા નિશ્ચિત સમયગાળા (આશરે 10 થી 15 દિવસોમાં) ડિજિટલ કોપી મોકલી આપવામાં આવશે.
 11. ડિજિટલ કોપી પ્રાપ્ત થયા બાદ તેની કલર અથવા સાદી કોપી 02 વધારાની ઝેરોક્ષ કોપી સાથે કોલેજમાં જમા કરાવવાની રહેશે.
 12. ઉપરોક્ત તમામ પ્રક્રિયા નીચે દર્શાવેલ સમય-મર્યાદા સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. સમય-મર્યાદા પૂર્ણ થયા બાદ કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ માટે ગેર-લાયક ગણવામાં આવશે જેની ખાસ નોંધ લેજો.

PROVISIONAL ELIGIBILITY CERTIFICATE (P.E.C.)	WITH REGULAR FEE	WITH LATE FEE
	FROM: 09/08/2021	FROM: 01/11/2021
	LAST DATE: 08/10/2021	LAST DATE: 30/11/2021
	TOTAL FEE: 150/-	TOTAL FEE: 1500/-

13. ઉપરાંતમાં, સંપૂર્ણ પ્રક્રિયા સમયે કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે, તો તેના નિવારણ માટે અથવા કોઈપણ પ્રકારની માહિતી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના કાર્યલાયનો સંપર્ક કરવાનો રહેશે જેનો નંબર (0281) 2576511 છે.